

## ફિલેમોનને પત્ર

**1** અમારા પ્રિય મિત્ર અને અમારા સહ-કાર્યકર ફિલેમોનને ઉદ્દેશીને આ પત્ર છે.

આપણી બહેન આફિયા, અમારા એક સહ-કાર્યકર આર્થિપસ, અને તારા ધરમાંની એકુનીત મંડળી એ સર્વનાં નામ જોગ લખિતંગ.

**2** પ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા આપણો ભાઈ તિમાથી.

**3** દેવ આપણા પિતા અને પ્રભુ ઈસુ પ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.

### ફિલેમોનનો પ્રેમ અને વિશ્વાસ

**4** મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. અને તારા માટે હું હંમેશા મારા દેવની આભારસ્તુતિ કરું છું.

**5** દેવ અને સર્વ સંતો માટે તને જે પ્રેમ છે અને પ્રભુ ઈસુમાં તને વિશ્વાસ છે, તે વિષે મેં સાંભળ્યું છે. અને તારા એ વિશ્વાસ અને પ્રેમ બદલ હું દેવની આભારસ્તુતિ કરું છું.

**6** મારી પ્રાર્થના છે કે જે વિશ્વાસમાં તું સહભાગી થયો છે તેને લીધે પ્રિસ્તની દરેક સારી બાબત આપણામાં છે તે આપણને પ્રિસ્ત તરફ દોરી જાય છે તે સારી બાબત તું સમજું શકીશ.

**7** મારા ભાઈ, તેં દેવના લોકો પ્રત્યે પુષ્કળ પ્રેમ દર્શાવ્યો છે. તેં તેચ્યોને સુખી કર્યા છે. આથી મારા મનને ખૂબ જ આનંદ તથા દિલાસો મળ્યો છે.

### એક ભાઈની જેમ ઓનેસિમસનો સ્વીકાર કરજે

**8** એક બાબત છે કે જે તારે કરવાની છે અને પ્રિસ્તમાં તારા પ્રેમને કારણે તર્ણે તે કરવાની આજી આપવાની મને છૂટ છે.

**9** પણ હું તને આજી કરતો નથી; હું તો તને તે કામ કરવા જણાવું છું. હું પાઉલ છું, હવે હું વૃદ્ધ થયો છું, અને પ્રિસ્ત ઈસુના કારણે હું કેદી થયો છું.

**10** મારા પુત્ર સમાન ઓનેસિમસ વિષે હું તને કહું છું. હું જ્યારે કેદમાં હતો ત્યારે તે મારો ધર્મપુત્ર થયો છે.

**11** ભૂતકાળમાં તો તે તારાં માટે નકામો જ હતો. પરંતુ તે હવે આપણા બંને માટે ઉપયોગી બન્યો છે.

**12** હું તારી પાસે તેને પાછો મોકલું છું. મારું પોતાનું હૈયું હું તેની સાથે મોકલું છું.

**13** સુવાતરિને કારણે હું જ્યારે જેલમાં છું એવા સમયે તે મને મદદરૂપ થાય, એ માટે હું તેને મારી પાસે જ અહીં રાખવા ઈચ્છિતો હતો. મને મદદ કરતાં કરતાં એ તારી જ સેવા કરે.

**14** પરંતુ એ માટે તેને અગાઉથી પૂછ્યા વિના કર્દી પણ કરવું મને ન ગમે. તારી પર દબાણ કરીને કામ સૌંપુ છું એમ નહિ પરંતુ મારા માટે તું જે કંઈ સારું કરે તે તારી સ્વેચ્છાથી થાય એમ હું ઈચ્છિ છું.

**15** ઓનેસિમસ થોડા સમય માટે તારાથી છૂટો પડી ગયો હતો, એવું કદાચ એટલા માટે બન્યું કે તે જ્યારે પાછો આવે ત્યારે હંમેશને માટે તારો થઈને રહે.

**16** દાસ તરીકે નહિ, પરંતુ દાસ કરતાં કંઈક વધારે સારો, વહાલા ભાઈ તરીકે હું તેને ખૂબ પ્રેમ કરું છું. પરંતુ તું એને વધારે પ્રેમ કરીશ. કેવળ એક મનુષ્યના રૂપે અને પ્રભુમાં સ્થિર એક પ્રિસ્તી ભાઈ તરીકે પ્રેમ કરજે.

**17** જો તારા ભિત્ર તરીકે તું મને સ્વીકારતો હોય તો, તું ઓનેસિમસને ફરી પાછો અપનાવી લેજે. મારું સ્વાગત કરે તેમ તું એને આવકારજે.

**18** ઓનેસિમસે જો તારા માટે કંઈક ખોડું કર્યું હોય અથવા જો તેણે તારું દેવું કર્યું હોય, તો તે મારા ખાતે ઉધારજે.

**19** હું પાઉલ છું, અને મારા પોતાના હાથે હું આ લખી રહ્યો છું. ઓનેસિમસનું જે કાંઈ દેવું હોય તે હું ભરપાઈ કરી આપીશ. અને જો કે તારા પોતાના જીવન માટે તું મારો કેટલો ઝણી છું, તે વિશે હું કશું જ નથી કહેતો.

**20** તેથી, મારા ભાઈ, પ્રભુમાં તું મારી માટે કઈક કરી બતાવ. પ્રિસ્તમાં મારા હિદ્યને તું શાંત કર.

**21** હું તને આ પત્ર લખું છું કારણ મને ખાતરી છે કે હું જે ઇચ્છાં છું તે કામ તું કરીશ જ. હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં પણ કઈક વધારે કરીશ.

**22** વળી, મારે રહેવા માટે પણ એક ઓરડો તું તૈયાર કરાવી રાખજે. મને આશા છે કે દેવ તારી પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર આપશે અને હું તારી પાસે આવી શકીશ.

### અંતિમ શુભેચ્છાઓ

**23** પ્રિસ્ત ઈસુ માટે કેદી બનેલો એપાફાસ પણ મારી સાથે છે. તે તને ક્ષેમકૃશળ કહે છે.

**24** વળી માર્ક, અરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક પણ તને ક્ષેમકૃશળ કહે છે. તેઓ મારી સાથેના કાર્યકરો છે.

**25** આપણા પ્રભુ ઈસુ પ્રિસ્તની કૃપા તમારા આત્મા પર થાઓ.

## પવિત્ર બાઇબલ

### **The Holy Bible in Gujarati, Easy Reading Version**

copyright © 1997-2009 World Bible Translation Center

Language: ગુજરાતી (Gujarati)

Translation by: World Bible Translation Center

License Agreement for Bible Texts World Bible Translation Center  
 Last Updated: September 21, 2006 Copyright © 2006 by World Bible Translation Center All rights reserved. These Scriptures: ☐ Are copyrighted by World Bible Translation Center. ☐ Are not public domain. ☐ May not be altered or modified in any form. ☐ May not be sold or offered for sale in any form. ☐ May not be used for commercial purposes (including, but not limited to, use in advertising or Web banners used for the purpose of selling online add space). ☐ May be distributed without modification in electronic form for non-commercial use. However, they may not be hosted on any kind of server (including a Web or ftp server) without written permission. A copy of this license (without modification) must also be included. ☐ May be quoted for any purpose, up to 1,000 verses, without written permission. However, the extent of quotation must not comprise a complete book nor should it amount to more than 50% of the work in which it is quoted. A copyright notice must appear on the title or copyright page using this pattern: "Taken from the HOLY BIBLE: EASY-TO-READ VERSIONTM © 2006 by World Bible Translation Center, Inc. and used by permission." If the text quoted is from one of WBTC's non-English versions, the printed title of the actual text quoted will be substituted for "HOLY BIBLE: EASY-TO-READ VERSIONTM." The copyright notice must appear in English or be translated into another language. When quotations from WBTC's text are used in non-saleable media, such as church bulletins, orders of service, posters, transparencies or similar media, a complete copyright notice is not required, but the initials of the version (such as "ERV" for the Easy-to-Read VersionTM in English) must appear at the end of each quotation. Any use of these Scriptures other than those listed above is prohibited. For additional rights and permission for usage, such as the use of WBTC's text on a Web site, or for clarification of any of the above, please contact World Bible Translation Center in writing or by email at distribution@wbtc.com. World Bible Translation Center P.O. Box 820648 Fort Worth, Texas 76182, USA Telephone: 1-817-595-1664 Toll-

Free in US: 1-888-54-BIBLE E-mail: info@wbtc.com WBTC's web site –  
World Bible Translation Center's web site: <http://www.wbtc.org>

2013-11-04

---

PDF generated using Haiola and XeLaTeX on 18 Apr 2025 from source  
files dated 31 Aug 2023  
e7105d68-9195-5020-a313-7baf29791a07